

May 18, 2026

To,  
**BSE Limited**  
Dept. DSC\_CRD  
Phiroze Jeejeebhoy Towers,  
Dalal Street  
Mumbai 400 001  
BSE Scrip Code: **506222**

**National Stock Exchange of India Limited**  
Exchange Plaza,  
Plot No. C/1, 'G' Block,  
Bandra- Kurla Complex,  
Bandra ('E'), Mumbai 400 051  
NSE Symbol: **STYRENIX**

**Sub:** Newspaper Publication – Regulation 30 and Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('Listing Regulations')

Dear Sir/ Madam,

Pursuant to Regulation 30 read with Schedule III and Regulation 47 of Listing Regulations, please find enclosed extracts of the newspaper publication of the Audited Standalone and Consolidated Financial Results for the 4th quarter and financial year ended on March 31, 2026, published today i.e., May 18, 2026, in Vadodara Samachar (in Gujarati) and Business Standard (in English).

The above information is also available on the website of the Company [www.styrenix.com](http://www.styrenix.com).

This is for your records and further dissemination.

Thanking You,

Yours faithfully,

For **Styrenix Performance Materials Limited**

Chintan Doshi  
Manager – Legal & Company Secretary

Encl: As above

**Styrenix Performance Materials Limited**  
(formerly known as INEOS Styrolution India Ltd.)

**Registered Office**

9th Floor, 'SHIVA', Sarabhai Compound, Dr. Vikram  
Sarabhai Marg, Vadiwadi, Vadodara - 390 023. Gujarat, India.

+91 265-2303201/02

secshare@styrenix.com

www.styrenix.com

CIN : L25200GJ1973PLC002436



**PUBLIC NOTICE**

Notice is hereby given to public at large on instruction of my client that non Agricultural Land bearing Final Plot No. 74+75 adm. about 1778 sq. mtrs. of TP Scheme No. 3, City Survey Nos. NA515/p1 & NA516/p1, Block/Survey Nos. 515 & 516, Mouje - Kudasan, Gandhinagar owned by Sharadam Realty, a Partnership Firm and they lost original (1) Sale Deed No. 3208/2005 & RR, (2) Sale Deed No. 1946/2004 & RR, (3) Sale Deed No. 10816/2004 & RR, & (4) Sale Deed No. 385/2003 & RR. Any persons having rights, title, claim, interest, charge, litigation etc. in or over the said property are hereby called upon to inform and intimate to me in writing alongwith proof thereof within 7 days from the date of publishing of this notice at my below mention address, failing which it shall be presumed that no one else has any right, title, claim, charge, litigation, etc. on/or against the said property and if any, the same has been waived and thereafter I shall issued the No Claim Certificate to the said property and no one else shall be entitled to raise any dispute or objection in future.

**Nayan C. Kansara, Advocate.**

Office Address at - 610, Hemkut Complex, B/h Janpath Mobile Market, Opp. Sanyash Ashram, Ashram Road, Ahmedabad-380009.  
M-9909950002

**PUBLIC NOTICE REGARDING TITLE CLEARANCE**

Yadav Brijeshkumar Sureshkumar intending to sale property bearing **PLOT NO. 178** (as per the approved plan), area admeasuring about 51.95 sq.yrds. i.e. 43.44 sq.mtrs., together with construction standing thereon comprising Ground Floor and First Floor having total built-up area of 86.88 sq.mtrs., in the residential society which is known and named as "PANCHDEV BUNGALOWS", situated on the non-agriculture land bearing Revenue Survey No. 8/2, Block No. 7 admeasuring, 20097.00 sq.mtrs. of Village : Karavda, Sub-District : Choryasi, District : Surat by agreement to sale executed and notarized on dated, 11.04.2026 in favour of DEEPAJI SINGH. He stated that (1) Original rectification deed registered in the office of sub-registrar, Surat - 6 (Kumbharyia) at serial No. 2099 dated 27/03/2018 alongwith original registration receipt of the said deed executed in favour of their previous owner have been lost/misplaced. Any person having or claiming any objection about said lost document is hereby requested to intimate in writing with all necessary and supporting documents within 7 days from the date of publication hereof, failing which it shall be presumed that there are no objections and that objections, if any, have been waived off and the undersigned shall proceed to issue a Title Certificate in respect of the same. Bank of Baroda, Surat shall have First Charge on said property of which public should take note. (Dt. 18/05/2026)

Office: "ShivShakti", 312, Royal Trade Center, Opp. Star Bazar, Surat-Hajira Road, Adajan, Surat. Mo.: 97129-39292, 93745-39292

**Rajendrasinh T. Thakor**  
Advocate & Notary

**PUBLIC NOTICE**

I Prayas N. Soni, Advocate hereby informed that our client Yogeshbhai Rameshchandra Agrawal is the owner of property situated at Saiyed Vasna, House No. B/29 "Lakulsh Nagar". The said scheme is constructed on R.S.No. 260, Sheet No. 39, City Survey No. 1441. The Original RR & Sale Deed in favour of Mansukhbhai Maganbhai Gangudia bearing No. 1721/2000 & The Original RR & Agreement to sale in favour of Vinubhai Ramanbhai Rohit bearing No. 11730/2024 & The Original RR & Cancelled Agreement to sale in favour of Yogeshbhai Rameshchandra Agrawal bearing No. 322/2025 are lost and inspite of several attempt it could not be found & hence this notice is issued. If anybody is having any objection, claim, interest, dispute for the above-mentioned property he/she/they may contact the undersigned with documentary proof within (7) seven days from the date of this publication. Please note that after expiring of the notice period Title Clearance Report shall be issued.

NO. 4, SHIV VATIKA SOCIETY, B/H MANJALPUR TOWNSHIP NO. 1, MANJALPUR, VADODARA (M) 982567500

**PRAYAS N. SONI**  
ADVOCATE & NOTARY

**PUBLIC NOTICE**

That a customer of our client financial institution intend to obtain loan against the All the piece of immovable property bearing non-agricultural plot of land in All the piece of immovable property bearing Non-agricultural Plot of land Situated at Mauje Dabhoi, Vadodara lying being land bearing R.S. no. 1462 Paikki T.P. Plan no. 1, F. P. no. 49, admeasuring 4111.00 Sq. Mtrs., Know as "SATYAM PARK SOCIETY" Sub House no. A/3, Plot admeasuring 60.40 Sq. Mtrs., i.e. 650.00 Sq. Mtrs., Construction admeasuring 40.00 Sq. Mtrs., Remain 20.40 Sq. Mts., at Registration Sub-District Dabhoi & District Vadodara At now said property owner Pandya Priteshkumar Rameshchandra the said property's Chain (First Chain Transfer Document) Sale deed executed by I. Rasikbhai Lallubhai Patel 2, Kishanbhai Lallubhai Patel through POA Haldar Sharma Anilkumar Ramkumar in favour of Rakeshbhai Sureshbhai Patel before the Sub Registrar Dabhoi Vides Registration no. 2248 dated 28.09.2010 But Said Sale Deed Reg. Receipt and Reg. Sale deed has Missing. Thus by this public notice I hereby call upon if any person or institution Bank or others who claims the lawful custody or domain in respect of the above mentioned document or having any charge, lien or encumbrance in respect of the captioned property may communicate within 7 days from the date of Publishing this public Notice with detailed documentary evidence of the transaction entitling them to Registered Post AD at the address mentioned below, failing which the Title clearance certificate shall be issued and no claim or objection shall be entertained after the expiry of the above said period after the expiry of the above said period.

Khushbu K Gohil (ADVOCATE) (Guj. High Court) Mob: 9824529323  
Office: Office No.301, 3rd Floor, Shilpi Signature, Court Road, Bharuch-392001.

**Indian Bank**  
Vesu Branch: Plot No. 4, AVALON The Business HUB, B/H S.D. Jain School, Big Bazar Lane, Vesu, Surat.

**POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)**  
Whereas, The undersigned being the authorized officer of the Indian Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 13/10/2025 calling upon the Borrower/Mortgagor Mrs. Lilaaben Indreshkumar Lakdawala (Borrower) & Mr. Indreshkumar Hasumukhlal Lakdawala (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs.13,12,928.00 (Rupees Thirteen Laks Two Thousand Nine Hundred Twenty Eight Only) plus interest & other legal charges thereon within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the 12th Day of May of the year 2026. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Indian Bank for an amount of Rs.13,27,270.00 as on 12/05/2026 plus interest & other legal charges thereon. The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of the time available, to redeem the secured assets.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**  
All the piece or parcel of immovable property known as Flat No.102 admeasuring 750.00 sq.ft. ie. 69.68 sq. mtrs. Super Built up area 436 Sq.ft. i.e. 40.51 sq.mtr built up area on the First Floor of "JAY MATAJI RESIDENCY" along with undivided proportionate share in the land underneath the said building, constructed on the land bearing Nondh No.1822 of city survey ward No.8, situated at Kirparam Mehta No Khancho, Gopipura, Surat.  
Date: 12/05/2026  
Place: Surat  
Authorised Officer, Indian Bank.

**Styrenix Performance Materials Limited**  
CIN : L25200GJ1973PLC002436  
Registered Office : 9th Floor, "Shiva", Sarabhai Complex, Dr. Vikram Sarabhai Marg, Vadiwadi,, Vadodara - 390 023, Gujarat, India.  
Tele : +91 265-2303201 / 02 E-Mail : secshare@styrenix.com Website : www.styrenix.com  
(INR in Crores)

**Statement of Standalone Audited Financial Results For the Quarter and Year Ended March 31, 2026**

Particulars	For the Quarter ended		For the Year Ended	
	Mar 31, 2026 (Audited)	Mar 31, 2025 (Audited)	Mar 31, 2026 (Audited)	Mar 31, 2025 (Audited)
1 Revenue from operations	656.36	701.66	2,640.27	2,744.38
2 Other income	2.08	1.27	6.43	10.78
3 Total income (1 + 2)	658.44	702.93	2,646.70	2,755.16
4 Expenses				
Cost of materials consumed	461.53	557.13	1,916.54	2,176.32
Changes in inventories of finished goods and work-in-progress	(10.77)	(37.16)	29.96	(116.05)
Employee benefits expense	18.26	18.82	75.23	70.31
Other expenses	63.33	81.13	255.25	268.78
Total expenses (4)	532.35	619.92	2,276.98	2,399.36
5 PBDIT : Profit before Depreciation, Interest and Tax expense (3 - 4)	126.09	83.01	369.72	355.80
6 Finance Costs	1.30	0.95	5.55	3.53
7 PBDT : Profit before Depreciation and Tax expense (5 - 6)	124.79	82.06	364.17	352.27
8 Depreciation and amortisation expense	12.76	10.04	47.08	39.30
9 Profit before Exceptional items and tax (7 - 8)	112.03	72.02	317.09	312.97
10 Exceptional items	(0.33)	-	2.78	-
11 Profit before tax (9 - 10)	112.36	72.02	314.31	312.97
12 Tax expense				
Current tax	27.52	21.51	82.37	84.72
Deferred tax charge / (credit)	0.53	(2.65)	(2.33)	(3.92)
Total tax expense (12)	28.05	18.86	80.04	80.80
13 Profit for the Period / Year (11 - 12)	84.31	53.16	234.27	232.17
14 Other comprehensive income Items that will not be reclassified to profit or loss				
Remeasurements of defined benefit plans - (Loss) / Gain	1.00	(0.33)	0.54	(0.62)
Income tax relating to remeasurements of defined benefit plans	(0.25)	0.08	(0.14)	0.16
Total other comprehensive income, net of tax (14)	0.75	(0.25)	0.40	(0.46)
15 Total comprehensive income for the Period / Year (13 + 14)	85.06	52.91	234.67	231.71
16 Paid-up equity share capital (Face value of the share : INR 10)	17.59	17.59	17.59	17.59
17 Other Equity	-	-	972.82	833.10
18 Earnings per share				
Nominal value per equity share of INR 10 each				
Basic and Diluted (INR)	47.94	30.23	133.22	132.02

**Statement of Consolidated Audited Financial Results For the Quarter and Year Ended March 31, 2026**

Particulars	For the Quarter ended		For the Year Ended	
	Mar 31, 2026 (Audited)	Mar 31, 2025 (Audited)	Mar 31, 2026 (Audited)	Mar 31, 2025 (Audited)
1 Revenue from operations	826.10	939.71	3,438.03	2,982.42
2 Other income	11.79	2.67	16.37	12.18
3 Total income (1 + 2)	837.89	942.38	3,454.40	2,994.60
4 Expenses				
Cost of materials consumed	579.00	841.37	2,489.88	2,460.56
Changes in inventories of finished goods and work-in-progress	(9.29)	(161.78)	15.21	(240.67)
Employee benefits expense	36.09	38.53	147.92	90.02
Other expenses	104.31	134.36	441.82	322.01
Total expenses (4)	710.11	852.47	3,094.83	2,631.92
5 PBDIT : Profit before Depreciation, Interest and Tax expense (3 - 4)	127.78	89.91	359.57	362.68
6 Finance Costs	4.65	3.07	19.45	5.65
7 PBDT : Profit before Depreciation and Tax expense (5 - 6)	123.13	86.84	340.12	357.03
8 Depreciation and amortisation expense	30.40	25.79	114.09	55.04
9 Profit before Exceptional items and tax (7 - 8)	92.73	61.05	226.03	301.99
10 Exceptional items	(0.33)	-	2.78	-
11 Profit before tax (9 - 10)	93.06	61.05	223.25	301.99
12 Tax expense				
Current tax	23.17	20.12	61.53	83.33
Deferred tax charge / (credit)	(3.59)	(13.79)	(21.13)	(15.06)
Total tax expense (12)	19.58	6.33	40.40	68.27
13 Profit for the Period / Year (11 - 12)	73.48	54.72	182.85	233.72
14 Other comprehensive income				
Items that will not be reclassified to profit or loss				
Remeasurements of defined benefit plans - (Loss) / Gain	(1.06)	0.20	(1.08)	(0.07)
Income tax relating to remeasurements of defined benefit plans	0.16	(0.02)	0.19	0.05
Items that will be reclassified to profit or loss				
Changes in foreign exchange reserve	10.03	(1.59)	36.99	(1.59)
Total other comprehensive income, net of tax (12)	9.13	(1.42)	36.10	(1.61)
15 Total comprehensive income for the Period / Year (13 + 14)	82.61	53.30	218.95	232.11
16 Profit after tax attributable to:				
Owners of the company	73.48	54.72	182.85	233.72
Non-controlling interest	-	-	-	-
17 Other Comprehensive income attributable to :				
Owners of the company	9.13	(1.42)	36.10	(1.61)
Non-controlling interest	-	-	-	-
18 Total Comprehensive income attributable to :				
Owners of the company	82.61	53.30	218.95	232.11
Non-controlling interest	-	-	-	-
19 Paid-up equity share capital (Face value of the share : INR 10)	17.59	17.59	17.59	17.59
20 Other Equity	-	-	1,348.72	1,201.14
21 Earnings per share				
Nominal value per equity share of INR 10 each				
Basic and Diluted (INR)	41.79	31.11	103.98	132.91

**Notes :**  
1. The Standalone and Consolidated statements were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on May 16, 2026. The statutory auditor have expressed unmodified conclusion on the aforesaid results.  
2. The above is an extract of the detailed format of the financial results for the quarter and year ended Mar 31, 2026 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of these financial results are available on the Stock Exchange websites (www.bseindia.com / www.nseindia.com) and company's website (www.styrenix.com).  
3. The financial results of the Company have been prepared in accordance with Indian Accounting ("Ind AS") notified under Section 133 of the Companies Act 2013 ("Act") read with Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended.  
4. The same can be accessed by scanning the QR Code provided below :



For Styrenix Performance Materials Limited  
Sd/-  
**Rakesh S Agrawal**  
Chairman  
DIN : 00057955

Place : Vadodara  
Date : May 16, 2026

IN THE MUMBAI DEBTS RECOVERY TRIBUNAL NO. II (Ministry of Finance) 3rd Floor, Telephone Bhavan, Strand Road Calaba, Mumbai- 400005

ORIGINAL APPLICATION NO. 410 of 2025 EXHIBIT: 11

ICICI Bank Limited ...Applicant  
Versus  
Mr. Suresh Panchobhai Boricha ...Defendants

To, 1. Mr. Suresh Panchobhai Boricha an adult Indian inhabitant, having his address at Flat No. 605, A Wing, Montana CHS Ltd. CTS Number 1, 2nd Cross Lane, Lohandwala Complex, Mumbai- 400053, Maharashtra.  
Also at: Jai Ambe Nagar, Plot No. 25, Near Vaishali Complex, Anjar, Kutch, Gujarat- 370110, Gujarat.  
Also at: Shree S.P. Roadways (Proprietary Concern of Mr. Suresh Panchobhai Boricha) at 101, Crystal Plaza Versova Link Road, D. N. Nagar, Andheri West- 400053, Maharashtra.

**SUMMONS**  
WHEREAS O.A. No. 410 of 2025 was listed before Hon'ble Presiding officer on 07/07/2025  
WHEREAS this Hon'ble Tribunal is pleased to issue summons on the said application under section 19(4) of the Act, (OA) filed against you for recovery of debts of Rs.27,90,285.84/- (Rupees Twenty Seven Lakh Ninety Thousand Two Hundred Eighty Five and Paise Eighty Four Only). (Application along with documents etc. annexed).  
WHEREAS the service of summons could not be effected in ordinary manner and whereas the Application for substituted service has been allowed by this Hon'ble Tribunal.

In accordance with sub-section (4) of section 19 of the Act, you, the Defendants are directed as under:  
1. To show cause within 30 thirty days of the service of summons as to why relief prayed for should not be granted.  
2. To disclose particulars of properties of assets other than properties and assets specified by the applicant under serial Number 3(A) of the Original Application.  
3. You are restrained from dealing with or disposing if secured assets of such other assets and properties disclosed under serial Number 3(A) of the Original Application, pending hearing and disposal of the application for attachment of the properties.  
4. You shall not transfer by way of sale, lease or otherwise, except in the ordinary course of business any of the assets over which security interest is created and/or other assets and properties specified disclosed under Serial No. 3A of the Original Application without the prior approval of the Tribunal.  
5. You shall be liable to account for the sale proceed realized by sale of secured assets or other assets and properties in the ordinary course of business and deposit such sale proceeds in the account maintained with bank of financial institution holding security interest over such assets.  
6. You are also directed to file written statement with a copy thereof furnished to the applicant and to appear before DRT-II on 17.08.2026 at 11:00 a.m. failing which the application shall be heard and decided in your absence.  
Given / Issued under my hand and the seal of this Tribunal on this 31st day of December, 2025.  
Registrar  
DRT - II, Mumbai

**SYMBOLIC POSSESSION NOTICE**

ICICI Bank Branch Office: ICICI Bank Ltd Office Number 201-B, 2nd Floor, Road No. 1 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane (West)- 400604

The Authorised ICICI Bank Officer under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notices to the borrower(s) mentioned below, to repay the amount mentioned in the Notice within 60 days from the date of receipt of the said Notice.  
Having failed to repay the amount, the Notice is issued to the borrower and the public in general that the undersigned has taken symbolic possession of the property described below, by exercising powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property. Any dealings with the property will be subject to charges of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower(s)/ Loan Account Number	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs)	Name of Branch
1.	M/s. G. L. Traders/ Mr. Ashokkumar Laxmanbhai Patel/ Mr. Girishkumar Laxmanbhai Patel/ Mrs. Sabhnaben Ashokkumar Patel/ Mr. Laxmanbhai Shivarambhai Patel/ 140305005303	Property- 4 Residential Bungalow Bearing Plot No. 119. In The Society Known As Heritage City, Situated At Consolidated Revenue Survey No. 190P1, Within The Limit of Kasbe Visnagar Nagarpalika, Taluka & Sub-registration District Visnagar, Registration District Mehnsana- Owned By Mr. Girishkumar Laxmanbhai Patel/ Admeasuring Total Plot Area 155 Square Meter (Construction Thereon- 58.81 Square Meter, Margin Land- 33.19 Square Meter And C.O.P. Road And Undivided Proportionate Share In Land For Common Usage 63.00 Square Meter)/ Bounded By:- North- Plot No. 120/ South- Plot No. 118/ East- Plot No. 117/ West- Internal Road of Survey No. 190P1/ Property- 5: Residential Bungalow Bearing Plot No. 121, In The Society Known As Heritage City, Situated At Consolidated Revenue Survey No. 190P1, Within The Limit of Kasbe Visnagar Nagarpalika, Taluka & Sub-registration District Visnagar, Registration District Mehnsana- Owned By Mr. Ashokkumar Laxmanbhai Patel/ Admeasuring Total Plot Area 155 Square Meter (Construction Thereon- 58.81 Square Meter, Margin Land- 33.19 Square Meter And C.O.P. Road And Undivided Proportionate Share In Land For Common Usage 63.00 Square Meter)/ Bounded By:- North- Plot No. 122/ South- Plot No. 120/ East - Plot No. 115/ West- Internal Road of Survey No. 190P1/ May 14, 2026	December 17, 2025 Rs. 1,64,89,524.14/-	Visnagar

The above-mentioned borrowers(s)/guarantors(s) is/are hereby issued a 30 day Notice to repay the amount, else the mortgaged properties will be sold for 30 days from the date of publishing this Notice, as per the provisions under Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.  
Date: May 18, 2026 Place: Visnagar(Mehnsana) & Ahmedabad Sincerely Authorised Officer, For ICICI Bank Ltd.

**SYMBOLIC POSSESSION NOTICE**

ICICI Bank Branch Office: ICICI Bank Ltd Office Number 201-B, 2nd Floor, Road No. 1 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane (West)- 400604

The Authorised ICICI Bank Officer under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notices to the borrower(s) mentioned below, to repay the amount mentioned in the Notice within 60 days from the date of receipt of the said Notice.  
Having failed to repay the amount, the Notice is issued to the borrower and the public in general that the undersigned has taken symbolic possession of the property described below, by exercising powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property. Any dealings with the property will be subject to charges of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower(s)/ Loan Account Number	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs)	Name of Branch
1.	M/s. Corporate Stay Solutions/ Mr. Nilesh Dilipkumar Shukla/ Mrs. Hetalben Nilesh Shukla Alias Mrs. Hetal Dave/ 058605005515	Unit No. E/3/23 (As Per B. U. Plan Unit No. E/3/203), 2nd Floor of Block No. E/3, In The Scheme Known As Orchid Heaven Situated At N.A. Land Bearing Revenue Survey No. 339,340,341 & 342 of Moje Village Sarkhej, Taluka Vejalpur (Old Taluka- Ahmedabad City West), Sub-Registration District Ahmedabad- 4 (Poldi), Registration District Ahmedabad, Gujarat, Owned By Mr. Nilesh Dilipkumar Shukla/ Admeasuring Super Built Up Area 184.41 Square Meter i.e. 1985 Square Feet, Carpet Area 99.50 Square Meter And Other Area For Exclusive Use 7.90 Square Meter/ Bounded By:- North- Unit No. E/3/22/ South- Society Road/ East- Block No. E/4/ West- Unit No. E/3/24/ May 13, 2026	February 27, 2026 Rs. 54,81,633.70/-	Ahmedabad
2.	M/s. Sri Samarth Utility Services Private Limited/ Mr. Ravi Chetan Palan/ Mrs. Devyani Chetan Palan/ Mr. Chetan Harish Palan/ 471305500056	Property- 3 Flat No. 12 Situated on First Floor of Siddharth Apartment Scheme Standing/ Constructed on The Land Bearing City Survey No. 1175, Sheet No. 121, Ward No. 5, Plot No. 194, Vijaynagar Area, Situated, Lying And Being At Mouje Bhuj, Taluka & Sub- Registration Bhuj And Registration District Kachchh/ Admeasuring Carpet Area 67.50 Square Meter i.e. Build Up Area 77.44 Square Meter/ Bounded By:- North - Common Passage/ South - Open Space/ East - Common Passage & O. T. S./ West - Road/ May 14, 2026	December 17, 2025 Rs. 1,93,14,334.90/-	Ahmedabad

The above-mentioned borrowers(s)/guarantors(s) is/are hereby issued a 30 day Notice to repay the amount, else the mortgaged properties will be sold for 30 days from the date of publishing this Notice, as per the provisions under Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.  
Date: May 18, 2026 Place: Ahmedabad, Bhuj Sincerely Authorised Officer For ICICI Bank Ltd.

## નિકાસ બંધ થતાં લોકલ માર્કેટમાં માલનો ભરાવો

## ઈરાન-ઈઝરાયેલ યુદ્ધે વલસાડની ફેરીની મીઠાશ બગાડી નાખી

● વલસાડ, તા.૧૭

જિલ્લામાં ફેરીની સિઝન પુરબહારમાં શરૂ થઈ છે. જોકે અગાઉ પ્રતિકૂળ વાતાવરણને કારણે ફેરીના પાકમાં નુકસાન વેધી ચૂકેલા ખેડૂતોને હવે બમણો માર પડી રહ્યો છે.

આ વખતે ખાડીના દેશોમાં યુદ્ધના માહોલને કારણે વલસાડની ખાડીના દેશોમાં થતું ફેરીનું એક્સપોર્ટ વર્ષ અટકી ગયું છે. વધુમાં મુંબઈની બજારમાં પણ વલસાડની ફેરીના ભાવ ઓછા મળતા વેપારીઓ પણ હવે ઓછા ભાવે ફેરીની માગ કરતા હોવાથી ફેરીના ભાવ ગગડી ગયા છે. આથી ખેડૂતોએ ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે.

વલસાડ જિલ્લો વાડીઓનો પ્રદેશ છે, જ્યાં ૩૫,૦૦૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. દર વર્ષે હજારો ટન ફેરીની અહીં ઉપજ થાય છે. વલસાડી આકુસ અને કેસર ફેરીની ખાડીના દેશોમાં મોટી માગ હોય છે. જેથી વલસાડ

માહોલમાં ઊંચા ભાવે આપવા તૈયાર નથી. શરૂઆતમાં પ્રતિકૂળ વાતાવરણને કારણે ફેરીના પાકને નુકસાન થયું હતું. જોકે, હવે યુદ્ધના કારણે એક્સપોર્ટ અટકી જતાં વધુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

વેપારી મુસ્તાક અલીએ જણાવ્યું હતું કે, અમારી કેસર આકુસ ફેરીની ખૂબ માગ હોય છે, પણ આ વર્ષે યુદ્ધના કારણે એક્સપોર્ટ થતું નથી અને ફેરીના સ્ટોકનો ભરાવો થઈ રહ્યો છે. ભાવ પણ મળતો ન હોવાથી અમને ખૂબ નુકસાન જઈ રહ્યું છે. દુબઈ પણ અમે ફેરી એક્સપોર્ટ કરતા હતા તે પણ નથી જતી અને મુંબઈ વલસાડ મોકલેલી ફેરીઓ પણ આગળ જતી નથી. જ્યારે સ્થાનિક ફેરીઓ ખરીદે છે પણ ખૂબ પ્રમાણમાં ભાવ આવતો નથી.

એક્સપોર્ટ થતી ફેરીઓ બંધ થઈ જતા અહીંયાની સ્થાનિક માર્કેટમાં ફેરીના માલનો ભરાવો થયો છે. જેથી ફેરીના ભાવ ઓછા થઈ ગયા છે. મુંબઈથી ખરીદી માટે આવતા વેપારીઓ પણ હવે આવા

માહોલમાં ઊંચા ભાવે આપવા તૈયાર નથી. શરૂઆતમાં પ્રતિકૂળ વાતાવરણને કારણે ફેરીના પાકને નુકસાન થયું હતું. જોકે, હવે યુદ્ધના કારણે એક્સપોર્ટ અટકી જતાં વધુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

વેપારી મુસ્તાક અલીએ જણાવ્યું હતું કે, અમારી વલસાડી આકુસ ફેરીની ખૂબ માગ હોય છે, પણ આ વર્ષે જે યુદ્ધ ચાલુ છે તેના કારણે એક્સપોર્ટ થતું નથી જેથી લોકલ માર્કેટમાં જ ફેરી વેચાવા આવી રહી છે. જેના પરિણામે માર્કેટમાં ફેરીનો એટલો મુજબ, આ જળાશયનો કુલ વ્યાપ ૧૮૦૦ ચો.કિ.મી. અને જે થકી કુલ ૧૩,૦૦૦ મિલિયન ઘનમીટર (૧૦.૫૩ મિલિયન એકર ફૂટ) મીઠા પાણીનો જથ્થો ધરાવતા જળાશયનું નિર્માણ થશે. સમગ્ર યોજના આયોજન છે. કલ્પસર યોજનાના બંધની લંબાઈ કુલ ૬૦.૧૩ કિ.મી. છે. ૩મના મથાળા ઉપર ૧૬ ગાંધીય રસ્તા અને ૪ ટ્રેક રેલ્વેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

## વડાપ્રધાન મોદીના નેધરલેન્ડના પ્રવાસ દરમિયાન ગુજરાતની મહત્વાકાંક્ષી 'કલ્પસર યોજના' અંગે મહત્વના કરાર કરાયા

## રુ. ૧.૫૭ લાખ કરોડના ખર્ચે આકાર પામનારી કલ્પસર યોજના ૧૦-૧૨ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન

● અમદાવાદ, તા. ૧૭

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન ગુજરાતની જળ સુરક્ષાના કલ્પવૃક્ષ સમાન 'કલ્પસર યોજના'ને સાકાર કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. આ દરમિયાન કલ્પસર યોજના માટે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ટેકનિકલ સહકાર માટેના MoU-સમજૂતી કરાર પણ કરવામાં આવ્યાં છે. જેના કારણે ભારત અને નેધરલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને નેધરલેન્ડની જળ વ્યવસ્થાપન ક્ષેત્રના બહોળા કારણે એક્સપોર્ટ થતું નથી જેથી લોકલ માર્કેટમાં જ ફેરી વેચાવા આવી રહી છે. જેના પરિણામે માર્કેટમાં ફેરીનો એટલો મુજબ, આ જળાશયનો કુલ વ્યાપ ૧૮૦૦ ચો.કિ.મી. અને જે થકી કુલ ૧૩,૦૦૦ મિલિયન ઘનમીટર (૧૦.૫૩ મિલિયન એકર ફૂટ) મીઠા પાણીનો જથ્થો ધરાવતા જળાશયનું નિર્માણ થશે. સમગ્ર યોજના આયોજન છે. કલ્પસર યોજનાના બંધની લંબાઈ કુલ ૬૦.૧૩ કિ.મી. છે. ૩મના મથાળા ઉપર ૧૬ ગાંધીય રસ્તા અને ૪ ટ્રેક રેલ્વેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

## ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા

● હાટકી, તા. ૧૭

યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં પવિત્ર અધિક માસના પ્રારંભના પહેલા દિવસે જ કરુણ ઘટના બની છે. જગવિખ્યાત ગોમતી નદીના ઘાટ પર (૧૬મી મે) વહેલી સવારે સ્નાન કરતી વખતે રાજકોટના એક જ પરિવારના બે સગા ભાઈઓ અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ એક ભાઈને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો છે, જ્યારે બીજો ભાઈ નદીના તેજ પ્રવાહમાં લાપતા થઈ ગયો છે. આ દુર્ઘટનાને પગલે પવિત્ર તહેવારના માહોલ વચ્ચે સમગ્ર ઘાટ પર હાજર શ્રદ્ધાળુઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના માહિતી અનુસાર, આજથી પવિત્ર ગણતારા અધિક માસનો વિધિવત પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકામાં ગોમતી નદીના સ્નાનનું સંવિશેષ ધાર્મિક મહત્વ હોવાથી વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓની ભારે ભીડ ગોમતીઘાટ પર ઉમટી પડી હતી. લોકો હરિનામ સ્મરણ સાથે પવિત્ર ડૂબકી લગાવી રહ્યા હતા, ત્યારે જ રાજકોટથી પરિવાર સાથે દર્શનાર્થે આવેલા બે યુવાન ભાઈઓ સ્નાન કરવા માટે પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન નદીના પ્રવાહ અને ઊંડાણનો અંદાજ ન આવતા બંને ભાઈઓ અચાનક પગ લપસવાથી ઊંડા પાણીમાં ગરકાવ થયા

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગટિ હેઠળ છે. આગામી ૨ વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

## જૂનાગઢના સનસનાટી મચાવનાર કેસમાં ખુલાસો પૈસાની લેતીદેતી બાબતે મહિલાની હત્યા પુત્રના મિત્રએ કરી હતી

● જૂનાગઢ, તા. ૧૭

શહેરના ગિરિરાજ વિસ્તારમાં ચિત્રકૂટ સોસાયટીમાં થોડા દિવસ પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૃતક મહિલાના પુત્રના મિત્રએ જ પૈસાની લેતીદેતી બાબતે હત્યા કર્યાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપીને ઊંડાપૂર્વકની તપાસ હાથ ધરી છે. ૫૮ વર્ષીય સુનિતા રાયજ નામની મહિલાની ગત ૧૨ મે ૨૦૨૬ મંગળવારના રોજ સાંજના સમયે જૂનાગઢ શહેરના ગીરીરાજ વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ સોસાયટીમાં રહેણાંક મકાનની અંદરથી કારણકે, મૃતક સુનિતા દ્વારા બનાવ ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના બાવમાં સંવોધાયેલ મૃ

તકના પુત્ર અને ફરિયાદી દિલીપ રાયજના મિત્ર ઉદ વર્ષીય સુરેશ ઉર્ફે કાનો વાઘવાણી નામના વ્યક્તિની પરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક તેમજ આરોપી જુના પાડોશી હોવાનું સામે આવ્યું છે. બનાવ સમયે જુનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બનાવ સ્થળની વિગીટ કરવામાં આવી હતી. ત્યારે સ્થળની વિગીટ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા કોઈ જાણભેદુ વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોવાની શંકા ઉદભવી હતી.

કારણકે, મૃતક સુનિતા દ્વારા બનાવ ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના બાવમાં સંવોધાયેલ મૃ

તકના પુત્ર અને ફરિયાદી દિલીપ રાયજના મિત્ર ઉદ વર્ષીય સુરેશ ઉર્ફે કાનો વાઘવાણી નામના વ્યક્તિની પરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક તેમજ આરોપી જુના પાડોશી હોવાનું સામે આવ્યું છે. બનાવ સમયે જુનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બનાવ સ્થળની વિગીટ કરવામાં આવી હતી. ત્યારે સ્થળની વિગીટ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા કોઈ જાણભેદુ વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોવાની શંકા ઉદભવી હતી.

કારણકે, મૃતક સુનિતા દ્વારા બનાવ ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના બાવમાં સંવોધાયેલ મૃ

Particulars		For the Quarter ended		For the Year Ended	
		Mar 31, 2026 (Audited)	Mar 31, 2025 (Audited)	Mar 31, 2026 (Audited)	Mar 31, 2025 (Audited)
1	Revenue from operations	656.36	701.66	2,640.27	2,744.38
2	Other income	2.08	1.27	6.43	10.78
3	Total income (1 + 2)	658.44	702.93	2,646.70	2,755.16
4	Expenses				
	Cost of materials consumed	461.53	557.13	1,916.54	2,176.32
	Changes in inventories of finished goods and work-in-progress	(10.77)	(37.16)	29.96	(116.05)
	Employee benefits expense	18.26	18.82	75.23	70.31
	Other expenses	63.33	81.13	255.25	268.78
	Total expenses (4)	532.35	619.92	2,276.98	2,399.36
5	PBDIT : Profit before Depreciation, Interest and Tax expense (3 - 4)	126.09	83.01	369.72	355.80
6	Finance Costs	1.30	0.95	5.55	3.53
7	PBDT : Profit before Depreciation and Tax expense (5 - 6)	124.79	82.06	364.17	352.27
8	Depreciation and amortisation expense	12.76	10.04	47.08	39.30
9	Profit before Exceptional items and tax (7 - 8)	112.03	72.02	317.09	312.97
10	Exceptional items	(0.33)	-	2.78	-
11	Profit before tax (9 - 10)	112.36	72.02	314.31	312.97
12	Tax expense				
	Current tax	27.52	21.51	82.37	84.72
	Deferred tax charge / (credit)	0.53	(2.65)	(2.33)	(3.92)
	Total tax expense (12)	28.05	18.86	80.04	80.80
13	Profit for the Period / Year (11 - 12)	84.31	53.16	234.27	232.17
14	Other comprehensive income				
	Items that will not be reclassified to profit or loss				
	Remeasurements of defined benefit plans - (Loss) / Gain	1.00	(0.33)	0.54	(0.62)
	Income tax relating to remeasurements of defined benefit plans	(0.25)	0.08	(0.14)	0.16
	Total other comprehensive income, net of tax (14)	0.75	(0.25)	0.40	(0.46)
15	Total comprehensive income for the Period / Year (13 + 14)	85.06	52.91	234.67	231.71
16	Paid-up equity share capital (Face value of the share : INR 10)	17.59	17.59	17.59	17.59
17	Other Equity	-	-	972.82	833.10
18	Earnings per share				
	Nominal value per equity share of INR 10 each	47.94	30.23	133.22	132.02
	Basic and Diluted (INR)				

Particulars		For the Quarter ended		For the Year Ended	
		Mar 31, 2026 (Audited)	Mar 31, 2025 (Audited)	Mar 31, 2026 (Audited)	Mar 31, 2025 (Audited)
1	Revenue from operations	826.10	939.71	3,438.03	2,982.42
2	Other income	11.79	2.67	16.37	12.18
3	Total income (1 + 2)	837.89	942.38	3,454.40	2,994.60
4	Expenses				
	Cost of materials consumed	579.00	841.37	2,489.88	2,460.56
	Changes in inventories of finished goods and work-in-progress	(9.29)	(161.78)	15.21	(240.67)
	Employee benefits expense	36.09	38.53	147.92	90.02
	Other expenses	10			